

RAN-2501001206047704
T.Y.B.A. (NCF-NEP) (Sem.-VI) Examination March - 2026
Economics: Managerial Economics (Minor) (Paper-VI-B)
સંચાલકિય અર્થશાસ્ત્ર
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) જમણી બાજુ દર્શાવેલા અંક પ્રશ્નના પુરા ગુણ દર્શાવે છે. Figures of the right indicate full marks of the questions. (3) As per the instruction no.1.	Seat No.: Student's Signature
--	--

- પ્ર.1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (કોઈપણ પાંચ) 10**
1. સમ ખર્ચ રેખાનો અર્થ આપો.
 2. સીમાંત ટેકનિકલ અવેજનો દર એટલે શું?
 3. ગતિશીલ કિંમત નીતિ એટલે શું?
 4. કિંમત નિર્ધારણ એટલે શું?
 5. ભૌતિક એકમના સંદર્ભમાં સમતુલ્ય બિંદુનું સૂત્ર લખો.
 6. મૂડીનો અર્થ આપો.
 7. નવપ્રવર્તન એટલે શું?
- પ્ર.2. સમ ઉત્પાદન રેખા એટલે શું? સમ ઉત્પાદન રેખા ઉદારહણ અને આકૃતિ સહિત સમજાવી, તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. 14**
- અથવા**
- પ્ર.2. અ. બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ સમજાવો. 07**
બ. આવકના વિવિધ ખ્યાલો આકૃતિની મદદથી સમજાવો. 07
- પ્ર.3. સમતુલ્ય વિશ્લેષણ એટલે શું? સમતુલ્ય વિશ્લેષણની ધારણાઓ અને ઉપયોગિતાઓ સમજાવો. 14**
- અથવા**
- પ્ર.3. અ. મૂડી અંદાજપત્રક મૂલ્યાંકનની પદ્ધતીઓ ચર્ચો. 07**
બ. નફો એટલે શું? નફાને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો. 07
- પ્ર.4. ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) 12**
1. ઉત્પાદકની સમતુલ્ય
 2. કિંમત નિર્ધારણ નીતિનું મહત્વ
 3. મૂડી અંદાજપત્રની લાક્ષણિકતાઓ
 4. નફાનો ગતિશીલતાનો સિદ્ધાંત

ENGLISH VERSION

- Q.1. Answer the following questions briefly. (Any Five) 10**
1. Give the meaning of Iso cost curve.
 2. What is rate of marginal technical substitution?
 3. What is dynamic pricing policy?
 4. What is pricing?
 5. Write the formula for the break- even point in terms of physical units.
 6. Give the meaning of capital.
 7. What is innovation?
- Q.2. What is Iso quant curve? Explain the Iso quant curve with an example and diagram, discuss its characteristics. 14**
- OR**
- Q.2. A. Explain the law of variable proportion. 07**
B. Explain the various concepts of revenue with the help of a diagram. 07
- Q.3. What is break- even analysis? Explain the assumptions and uses of break-even analysis. 14**
- OR**
- Q.3. A. Discuss the methods of capital budget evaluation. 07**
B. What is profit? Discuss the factors affecting profit. 07
- Q.4. Write short notes: (any two) 12**
1. Producer's equilibrium
 2. Importance of pricing policy
 3. The characteristics of Capital budgeting
 4. The dynamic theory of profit
-